

**SARDAR PATEL UNIVERSITY**  
**F.Y. B.Com. (SECOND SEMESTER) (CBCS) (REGULAR) EXAMINATION**  
**2012**  
**Thursday, 12<sup>th</sup> April**  
**11.00 a.m. to 1.00 p.m.**  
**UB02ECOM10 : BUSINESS MANAGEMENT : PAPER - IV**  
**(Financial Management-II)**

**કુલ ગુણ : ૬૦**

**નોંધ :** જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર.૧ કાર્યશીલ મૂડી એટલે શું ? ઘંઘામાં કાર્યશીલ મૂડીનું મહત્વ અને પ્રકારો સમજાવો. (૧૫)

**અથવા**

પ્ર.૧ ટૂંકનોંધ લખો :

અ) સેવાચક્ર (૦૭)

બ) કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો (૦૮)

પ્ર.૨ રોકડ રાખવાના ઉદ્દેશો સ્પષ્ટ કરો અને રોકડનું સંચાલન કરવાના હેતુઓ સમજાવો.  
(૧૫)

**અથવા**

પ્ર.૨ માલસામગ્રી સંગ્રહના ફાયદા અને જોખમો અંગે ચર્ચા કરો. (૧૫)

પ્ર.૩ માલસામગ્રી સંચાલનની પદ્ધતિઓની ચર્ચા યોગ્ય ઉદાહરણ સાથે કરો. (૧૫)

**અથવા**

પ્ર.૩ ટૂંકનોંધ લખો :

અ) લેણીહરૂંડીના હેતુઓ (૦૭)

બ) લેણીહરૂંડીના કદને અસર કરતા પરિબળો  
(૦૮)

પ્ર.૪ લેણી હરૂંડી સંચાલન એટલે શું ? લેણીહરૂંડીના સંચાલન માટેની વિવિધ નિતીઓની  
(૧૫)

સવિસ્તર ચર્ચા કરો.

**અથવા**

પ્ર.૪ 'અ' લીમિટેડ કંપનીના અંદાજીત વેચાણના આંકડા નીચે મુજબ છે :

(૧૫)

| માસ            | વેચાણ (રૂ.) |
|----------------|-------------|
| નવેમ્બર-૨૦૧૧   | ૮૦૦૦૦       |
| ડીસેમ્બર       | ૭૦૦૦૦       |
| જાન્યુઆરી-૨૦૧૨ | ૮૦૦૦૦       |
| ફેબ્રુઆરી      | ૧૦૦૦૦૦      |
| માર્ચ          | ૮૦૦૦૦       |
| એપ્રિલ         | ૧૦૦૦૦૦      |
| મે             | ૮૦૦૦૦       |

૨૦% વેચાણ રોકડ છે અને બાકીનું ઉધાર જે વેચાણના ત્રીજા માસમાં વસૂલવામાં આવે છે. નીચેની વધારાની માહિતી ઉપલબ્ધ છે.

- ખરીદી જે તે માસના વેચાણના ૬૦% જેટલી છે જેની ચૂકવણી ખરીદીના ૩ માસ પછી કરવામાં આવશે.
- અસ્થાયી ખર્ચા વેચાણના ૫% છે જેની ચૂકવણી અડધા માસ પછી કરવામાં આવશે.
- વેચાણ પર વટાવ ૫% લેખે વેચાણના ત્રણ માસ પછી ચૂકવાય છે.
- સ્થાયી મિલકતની ખરીદી રૂ. ૫૦૦૦૦, માર્ચ ૨૦૧૨.
- ભાડુ અને અન્ય ખર્ચા રૂ. ૩૦૦૦ની ચૂકવણી દર મહિને.
- કરવેરાની ચૂકવણી રૂ. ૨૦૦૦૦, એપ્રિલ-૨૦૧૨.
- ઉધડતી રોકડ સિલક રૂ. ૨૫૦૦૦.

ઉપરોક્ત માહિતી પરથી જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૨ સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

